

એપ્રિલ 11, 2018

શું તમે મ્યુનિસિપલ ઇલેક્શન માટે મતદાર યાદીમાં છો?

બ્રામ્પટન, ઓન્ટેરિયો – ઓક્ટોબર 2018 માં મ્યુનિસિપલ ઇલેક્શન થવાનું છે ત્યારે તેમાં આશરે છ મહિનાનો સમય બચ્યો છે, પરંતુ શું તમે મતદારોની પ્રારંભિક યાદીમાં છો કે કેમ તે તપાસવા અત્યારે જૂજ મિનિટોનો સમય વિતાવવાથી તમારા માટે આગળ સરળ રહેશે જ્યારે તમે મત આપવા જાવ. સીટી ઓફ બ્રામ્પટન પાત્રતા ધરાવતા તમામ બ્રામ્પટન મતદારોને વેબસાઈટ www.voterlookup.ca એ જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે કે શું તેઓને મતદારોની પ્રારંભિક યાદીમાં સમાવેલા છે અને એ કે યાદીમાં તેઓની માહિતી સાચી છે કે કેમ.

મ્યુનિસિપલ પ્રોપર્ટી એસેસમેન્ટ કોર્પોરેશન (MPAC) મતદારોની પ્રારંભિક યાદી જાળવે છે, જે મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડની ચૂંટણીઓ માટે મતદારોની યાદી તૈયાર કરવા ઉપયોગમાં લેવામાં આવે છે. Voterlookup.ca વેબસાઈટ એ MPAC ની ઓનલાઈન સેવા છે. તે મતદારો માટે એ પાકી ખાતરી કરવાની સરળ અને કાર્યક્ષમ રીત છે કે તેઓ આગામી મ્યુનિસિપલ અને સ્કૂલ બોર્ડની ચૂંટણીઓ માટે મત આપવા યાદીબદ્ધ છે, અને એ કે તેઓની માહિતી સાચી છે કે કેમ.

ઝાંખીઓ:

- પાત્ર મતદાર એ વ્યક્તિ છે જેઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ, કેનેડિયન નાગરિક, બ્રામ્પટનમાં રહેતા, અથવા બ્રામ્પટનમાં મિલકતના માલિક કે ભાડુઆત હોય, અથવા આવા માલિક કે ભાડુઆતના સાથી (સ્પાઉસ) હોય.
- આગામી મ્યુનિસિપલ ઇલેક્શન માટે તમારી માહિતી સચોટપણે નોંધાઈ હોવાની પાકી ખાતરી કરવા, વેબસાઈટ voterlookup.ca પર જાવ, અને તમારી મ્યુનિસિપાલિટી, તમારું પૂરું નામ, જન્મ તારીખ, અને કાં તો તમારી મિલકતનું સરનામું અથવા તો એસેસમેન્ટ રોલ નંબર લખી જણાવો.
- તમે અગાઉના મ્યુનિસિપલ ઇલેક્શનમાં મતદારોની યાદીમાં હતા તો પણ, યાદી અત્યારે જ તપાસી લો જેથી તમારી વિગતો સચોટ હોવાનું ચકાસી શકાય.
- શું તમે છેલ્લાં કેટલાક વર્ષોમાં 18 વર્ષના થયા? શું તમે તાજેતરમાં બ્રામ્પટનમાં સ્થળાંતર કર્યું અથવા શહેરમાં નવા સરનામે સ્થળાંતર કર્યું? શું તમે નવા કેનેડિયન નાગરિક છો? તમારી માહિતી વેબસાઈટ પર અદ્યતન કરો, voterlookup.ca
- વધુ માહિતી મેળવવા, વેબસાઈટ voterlookup.ca જુઓ અથવા MPAC નો સંપર્ક 1-866-296-6722 નંબર પર કરો અથવા TTY 1-877-889-6722

અવતરણ (ક્વોટ):

“MPAC ની voterlookup.ca વેબસાઈટ 2018 નાં મ્યુનિસિપલ ઇલેક્શન માટે મતદારોની યાદી તૈયાર કરવામાં મદતનું પહેલું પગલું છે. પાત્રતા ધરાવતા મતદારો યાદી પર તેઓની માહિતી અદ્યતન અને સચોટ હોવાની ખાતરી કરાવવામાં મદદરૂપ થઈ શકે છે – આનાથી મતદાનના દિવસે મતદાન સ્થળ પર સમય બચાવવામાં મદદ મળશે.”

- પીટર ફે (Peter Fay), સીટી ક્લાર્ક અને રિટર્નિંગ ઓફિસર (ચૂંટણી અધિકારી)

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે ગુંજી ઊઠતા શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે ધૂજતા નથી અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ વધારીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca